

# ખૂબ મહેનત કરવા છતાં પણ ફળ મળતું નથી? તો ફળપ્રાપ્તિ માટેની ચમત્કારિક ગુરૂચાવી

- ઝૂં ઋષિ પ્રિતેશભાઈ

“કર્મ કરો પણ ફળની આશા ન રાખો” ભગવદ ગીતામાં લખેલ આ વાતને દરેક સમજે છે પણ આજના આધુનિક વિષયકમાં ફળ વગર કામ કર્યા કરવું એ કોઇપણ વ્યક્તિ માટે શક્ય હોતું નથી. દરેક વ્યક્તિને પોતાની મહેનત સામે પૂરેપૂરું વળતર મેળવવાની ઇચ્છા હોય છે અને એ ઇચ્છા દરેક વ્યક્તિએ રાખવી જ જોઈએ એવું હું પણ માનું જ છું. ઘણીવાર વેપારીઓને એમના ધંધામાં મહેનત કર્યા પછી પણ નફો ઓછો મળતો હોય, ભણતા વિદ્યાર્થીઓ મહેનત કરવા છતાં પણ સારા માર્ક્સ ન લાવી શકતા હોય, વ્યવસાયક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓ પોતાની આવડત અને હોશિયારી છતાં પણ આર્થિક વળતર અને માન-સન્માન ન મળતું હોય, ગૃહિણીઓ પણ ઘરમાં કુટુંબને સાચવવા અને કુટુંબની દેખરેખ રાખવા છતાં પણ એમને જશ ના મળતો હોય, સમાજમાં સામાજિક કાર્ય સાથે જોડાયેલો માણસોને ગમે તેટલી મહેનત સારી કરવા છતાં પણ એમનો સામાજિક દરજ્જો અને મોભો ના વધતો હોય આવા બધા વ્યક્તિઓ માટે હું આ લેખ લખી રહ્યો છું.

હું મારી કવિતાની ચાર પંક્તિઓ લખી રહ્યો છું,

“ છે આવડત તો જીતી બતાડો,

ફળ મહેનતનું લઇ બતવો

જંગ ભલે હોય જીંદગી,

હાર્યા વગર લડી બતાવો ”

2009, નવેમ્બર મહિનામાં બનેલી સત્ય ઘટના અહીં રજૂ કરું છું. આ લેખોની શૃંખલામાં હું જે ઘટનાઓ લખી રહ્યો છું એ બધી સત્ય ઘટનાઓ છે. એકવાર એક મલ્ટીનેશનલ દવા બનાવતી કંપનીનાં આસીસ્ટન્ટ મેનેજર મારી પાસે આવ્યા. એમણે મને કહ્યું કે ગુરૂજી હું છેલ્લા 20 વર્ષથી દવા બનાવતી કંપનીઓમાં કામ કરી રહ્યો છું. અત્યારે પણ હું દવા બનાવતી એક કંપની સાથે જોડાયેલો છું. છેલ્લા 20 વર્ષથી કંપનીઓનાં ટાર્ગેટ હું સર કરીને આપતો રહ્યો છું છતાં પણ મને જોઈએ એટલું આર્થિક વળતર મળતું નથી તેમજ કંપનીમાં જે માન સન્માન મળવું જોઈએ એ પણ મળતું નથી. આવક વધે અને પ્રગતિ થાય એ માટે છેલ્લા 20 વર્ષમાં મેં મારી પાંચ નોકરી બદલી છે. આજે મારી ઉંમર 46 વર્ષની થઈ છે અને મારી મહેનતનું મને જે પૂર્ણ ફળ મળવું જોઈએ એ મળતું નથી. આપની નામનાં સાંભળી હું આપની પાસે આવ્યો છું. આપ મને મહેનતનું ફળ મળે એવી દિશા બતાવવાની કૃપા કરશો.

એ સજ્જનની વાત સાંભળી મેં એમને કહ્યું કે આપના મુખમુદ્રા અને ઓરાની પરિસ્થિતિ પરથી એવું ચોક્કસ દેખાય જ છે કે આપને આર્થિક સફળતા પુરેપુરી મળતી નથી પણ તમારી એક ખામી તમને કહી દઉં પહેલા. તમે 20 વર્ષમાં ઉતાવળ કરીને પાંચ જોબ બદલી ચૂક્યા છો જે યોગ્ય નથી. હા, સારી તક મળતી હોય તો લેવી જોઈએ પરંતુ તમારા કહેવા પ્રમાણે જ્યારે જ્યારે તમે નોકરી બદલી છે ત્યારે તમારી આર્થિક આવકમાં કોઈ મોટો વધારો થયો નથી છતાં પણ તમે તમારી ઉતાવળનાં કારણે અને બીજી કંપની તમને આર્થિક રીતે પ્રોત્સાહીત કરીને આગળ વધારશે એવું માનીને તમે નોકરી બદલતા ગયા છો. મારું કહેવું એવું છે કે અત્યારે તમે જે નોકરી સાથે જોડાયેલા છો એ નોકરી સાથે કાર્યરત રહો. તમે જે મહેનત કરી રહ્યા છો તેનું તમને પુરેપૂરું આર્થિક વળતર મળે એ માટે હું તમને એક ચમત્કારિક મંત્ર અને ઐંકાર ચાલીસા આપુ છું પણ આ મંત્ર અને ઐંકાર ચાલીસા સતત છ મહિના કર્યા પછી એનો ફાયદો દેખાશે. માટે ધીરજ રાખી અને મંત્ર કરશો.

નવ મહિના પછી એ સજ્જન મારી પાસે ફરી આવ્યા. તેમણે મને કહ્યું કે ગુરૂજી આપે આપેલા મંત્રથી મારા જીવનમાં ઘણો જ ફાયદો થઈ ગયો. છેલ્લા ત્રણ મહિના પહેલા જ જમીનનો એક નાનકડો ટુકડો જે મેં 15 વર્ષ પહેલા લીધો હતો જેમાં લીગલ પ્રોબ્લેમ હતો અને જેને હું લગભગ ભૂલી જ ગયો હતો અને મેં માની લીધું હતું કે આ જમીનમાં કશું મળવાનું નથી. અચાનક એ પ્રોબ્લેમ દૂર થઈ જવાથી મારો એ જમીનનો ટુકડો સારા ભાવે વેચાઈ ગયો. અને જેના માટે હું આપને મળ્યો હતો એ નોકરીમાં મને પ્રમોશન મળ્યું તેમજ પગારમાં પણ સારો વધારો મળ્યો અને મેનેજર બનાવી મને અમદાવાદ થી પૂના મોકલવામાં આવ્યો. તેમજ મારા કામની કદર કરવામાં આવી અને આ વર્ષ દરમિયાન કંપની માટે કામ કરવા બદલ શ્રેષ્ઠ કાર્યરત કર્મચારીનો એવોર્ડ પણ મળ્યો. આપે આપેલો મંત્ર હું નિયમિત કરતો રહીશ. આપના આશીર્વાદ મારા પર સદાય રાખજો. આ સજ્જનને મંત્રસાગરમાંથી મોતીરૂપ આપેલ મંત્ર હું આપને પણ આપુ છું. આ મંત્ર અને ઐંકાર ચાલીસા કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ ગણી શકે છે. આ મંત્ર 27 વખત અને ઐંકાર ચાલીસા એક વખત ગણવા. આ મંત્ર ગણતી વખતે તુલસીનાં સાત પાન લઈને બેસવાનું ડાબા હાથમાં તુલસીનાં પાન રાખવા અને જમણા હાથનાં આંગળીનાં વેઢાથી મંત્ર ગણવો અને ઐંકાર ચાલીસા વાંચી જવા.

મંત્ર: || ॐ સાદિકા સાદિકા કાર્યેષુ ત્રુવાન્ગ નમો નમઃ ||

|| ॐ નમઃ ||